

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ છે. જે પૈકીની નીચે દર્શાવેલ જાહેરાતોના સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ ઉમેદવારોની યાદી તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના તથા પરીક્ષાની તારીખ તા. તા. ૦૯/૧૦/૨૦૨૦ તથા ૧૨/૧૧/૨૦૨૦ ના રોજ મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. જે સંવર્ગોની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ અમદાવાદ ખાતે યોજાનાર છે. જે સંદર્ભે ઉક્ત દરેક સંવર્ગોની પરીક્ષા માટેના કોલ-લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ નીચે દર્શાવ્યા પ્રમાણેનો મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.

કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ

અ. નં.	જાહેરાત ક્રમાંક/ સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ/ સમય	કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ-સમયની વિગતો
૧	૧૬૭/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (મિકેનીકલ ગ્રુપ)	૦૬/૧૨/૨૦૨૦ ૧૧-૦૦ થી ૧૨-૧૫	તા. ૨૭/૧૧/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૦૬/૧૨/૨૦૨૦, સવારે ૧૧-૦૦ કલાક સુધી
૨	૧૬૮/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ફેબ્રીકેશન ગ્રુપ)		
૩	૧૭૨/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપ)		
૪	૧૭૫/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (કેમિકલ ગ્રુપ)		
૫	૧૭૭/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (કોમ્પ્યુટર ગ્રુપ)	૦૬/૧૨/૨૦૨૦ ૧૧-૦૦ થી ૧૨-૧૫ ૧૪-૩૦ થી ૧૫-૪૫	તા. ૨૭/૧૧/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૦૬/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૩૦ કલાક સુધી
૬	૧૬૯/૨૦૧૮(૧૯) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (રેફ્રિજરેશન એન્ડ એર કંડીશનીંગ ગ્રુપ)	૦૬/૧૨/૨૦૨૦ ૧૪-૩૦ થી ૧૫-૪૫	તા. ૨૭/૧૧/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાક થી તા. ૦૬/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૩૦ કલાક સુધી

૭	૧૭૦/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રીકલ ગ્રુપ)	૦૬/૧૨/૨૦૨૦ ૧૪-૩૦ થી ૧૫-૪૫	તા. ૨૭/૧૧/૨૦૨૦, બપોરે ૧૪-૦૦ કલાક થી
૮	૧૭૩/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (સીવીલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ)		તા. ૦૬/૧૨/૨૦૨૦, બપોરે ૧૪-૩૦ કલાક સુધી
૯	૧૭૪/૨૦૧૮૧૯ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઓટોમોબાઇલ ગ્રુપ)		

ઉમેદવારોએ જે તે સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના કોલ-લેટર તથા તે સાથેની જરૂરી સુચનાઓ સહિત ઉપર દર્શાવેલ નિયત તારીખ-સમયગાળા દરમ્યાન "[https:// ojas.gujarat.gov.in](https://ojas.gujarat.gov.in)" વેબસાઇટ પરથી અચૂક (ON LINE) ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

પ્રવેશપત્ર "ON LINE" ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) "[https: // ojas.gujarat.gov.in](https:// ojas.gujarat.gov.in)" વેબસાઇટ પર જવું. (૨) બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના ઉમેદવારોએ " Call Letter " પર "Click" કરવું. (૩) ત્યાર બાદ "Secondary/ Main Exam Call Letter" પર "Click" કરીને Select job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને OK પર Click કરવાથી અલગ Window માં આપનો Call letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે.)

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલ-લેટર તથા સુચનાઓની વિગતો કે જે સ્પર્ધાત્મક લેખિત કસોટી સમયે હાજરીપત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક વાંચી જવી. ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના નાયબ સચિવશ્રી (તાંત્રિક પરીક્ષા) નો કચેરી સમય દરમ્યાન ફોન નંબર:- ૦૭૯- ૨૩૨૫૩૬૨૮ પર સંપર્ક કરી શકાશે.

ઉમેદવારોએ ઉપર મુજબની સૂચનાઓ ઉપરાંત કોવિડ-૧૯ અન્વયેની નીચે મુજબની સૂચનાઓ પણ ધ્યાને લેવાની રહેશે.

- (૧) દરેક પરીક્ષાર્થીઓએ મોં પર માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તેમજ સોશીયલ ડીસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.
- (૨) પરીક્ષામાં ભાગ લેનાર તમામ પરીક્ષાર્થીઓ તેમજ કર્મચારી/ અધિકારીશ્રીઓનું ટેમ્પરેચર, ટેમ્પરેચર ગન દ્વારા માપવાનું ફરજિયાત રહેશે.
- (૩) તમામ પરીક્ષાર્થીઓ તેમજ મંડળના કર્મચારી/ અધિકારીશ્રીઓને હાથ ઉપર સેનેટાઇઝ સ્પ્રે લગાડીને પ્રવેશ આપવામાં આવશે

- (૪) તમામ પરીક્ષાર્થીઓ પીવાના પાણીની બોટલ જાતે જ સાથે લાવવી હિતાવહ છે. તેમ છતાં મંડળ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા (ડીસ્પોઝેબલ ગ્લાસ સાથે) કરવામાં આવશે.
- (૫) પરીક્ષા સ્થળ તેમજ કેમ્પસમાં પરીક્ષાર્થી સીવાય તેઓના સગા/સંબંધીઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં.
- (૬) કોવીડ-૧૯ અંતર્ગત કેન્દ્ર/રાજ્ય સરકારશ્રી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સ્થળ:- ગાંધીનગર

તારીખ- ૨૬/૧૧/૨૦૨૦



સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
ગાંધીનગર